

પ. ભાણેજ મામાના ઘરે ચોરી કરવાની ટીપ આપી અગાઉ વાહન ચોરી તથા ઘરફોડ ચોરીમા પકડાયેલા રીઢા ઘરફોડીયાને રાંદેર પો.સ્ટે.ની ઘરફોડ ચોરીના ગુનાના કામે પકડી ગુનાનો ભેદ ઉકેલતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ.

તા.૧૪/૦૭/૨૦૧૭.

રાંદેર પો.સ્ટે ફસ્ટ ગુ.ર.નં.૭૫/૨૦૧૭ ઇ.પી.કો.કલમ ૪૫૪,૪૫૭,૩૮૦ મુજબનો ગુનો ગઈ તા. ૭/૭/૨૦૧૭ ના કલાક ૮/૦૦ થી તા.૧૦/૭/૨૦૧૭ ના કલાક ૩/૩૦ વાગે મુસ્કાન રો હાઉસ ગોરાટ હનુમાન રોડ રાંદેર સુરત ખાતે સોનાના દાગીના તથા રાડો ઘડીયાળ તથા રોકડા `૨૨,૦૦૦/- મળી કુલે `૧,૭૨,૦૦૦/- ની ઘરફોડ ચોરીનો ગુનો દાખલ થયેલ હતો. જેમા પો.સ.ઇ. વી.વી.ભોલા નાઓએ ગુનાવાળી જગ્યાની વીઝીટ કરી સદર ગુનો શોધી કાઢવા માટેના પ્રયત્નો ચાલુ હતા.

જે દરમ્યાન રાજા ઓવારા પાસે હુસેની મસ્જીદ સામે હોપ પુલના નાકેથી એક આરોપી મોહમદ હુસેન S/O અબ્દુલ લતીફ મલીક ઉવ. ૩૫ ધંધો- પાપડીનો વેપાર રહે ૪૦૩, જૈનબ એપાર્ટમેન્ટ વરીયાવગામ, જહાંગીરપુરા રોડ, સુરત મુળગામ:- ઓલપાડ પરા વિસ્તાર તા.જી. સુરતનાને પોતાની મેસ્ટ્રો મોપેડ પરથી ઝડપી પાડી તેની પાસેથી (૧) સોનાનો હારનો એક સેટ કી. `૨,૧૮,૬૦૦/- તથા (૨) સોનાના પેન્ડલ વાળી ચેઇન કી. `૯૮૭૫/- (૩) સોનાની કાનની બુટી નંગ-૨ તથા પેન્ડલ કી. `૧૧,૧૦૦/- (૪) એક રાડો ઘડીયાળ કી. `૫૦૦૦/- તથા (૫) રોકડા રૂપીયા ૪,૬૫૦/- તથા (૬) મેસ્ટ્રો મોપેડ ગાડી કી. `૨૦,૦૦૦/- તથા (૭) એક હથોડી કી. `૦૦/૦૦ તથા (૮) એક પેચીયુ કી. `૦૦/૦૦ સાથે મળી કુલે કી. `૨,૬૯,૨૨૫/- નો મુદ્દામાલ મળી આવતા તથા આરોપીને ઉંડાણ પૂર્વક પુછપરછ કરતા તેણે જણાવેલ કે, ગઈ તા. ૦૭/૦૭/૨૦૧૭ થી તા. ૧૦/૭/૨૦૧૭ દરમ્યાન ઘર નંબર ૪, મુસ્કાન રો હાઉસ, રાંદેર ખાતેથી ફરીયાદી બહારગામ ગયેલ હોય અને ફરીયાદી ઇલ્યાસભાઈનો ભાણેજ આસીફ હુસેન મેમણએ પોતાને ટીપ આપેલ કે, તેના મામા અને તેનુ ફેમીલી બહારગામ જાય એટલે તુ ચોરી કરી લેજે. જેથી મે મુસકન રો હાઉસમાં બાજુના મકાનના પગથીયા વાટે ફરીયાદીના મકાનના ધાબા પર ચઢી ધાબા ઉપરના દીવાલની બારીમા ફીટ કરેલ સ્ટીલની ગ્રીલને પેચીયા વડે તોડી ગ્રીલ કાઢી નાંખી સ્લાઇડર બારી ખોલી પ્રવેશ કરી ગોદરેજની તીજોરીને ઇલેક્ટ્રીક કટરથી કાપી ચોરી કરતા હતા ત્યારે તા.૧૦/૭/૨૦૧૭ ના રોજ રાત્રીના સાડા ત્રણેક વાગ્યાના સુમારે ફરીયાદી અમદાવાદ ખાતેથી મેરેજમાંથી પરત આવતા ગેટ ખોલવાનો અવાજ થતા પકડાઇ જવાની બીકે આરોપી ચોરી કરવાના ઓજારો તથા પોતાનો મોબાઇલ ફોન સ્થળ ઉપર જ છોડી નાશી ગયેલ હતો. તેવી કબુલાત કરતા તમામ મુદ્દામાલ પંચનામાની વિગતે કબજે કરી આજરોજ તા.૧૪/૭/૨૦૧૭ ના કલાક ૧૧/૩૦ વાગે CRPC કલમ ૪૧(૧) ડી મુજબ અટક કરી ઉપરોક્ત ગુનાનો ભેદ ઉકેલી મુદ્દામાલ રીકવર કરી રાંદેર પો.સ્ટે. ને સોંપવા માટે તજવીજ કરવામાં આવેલ છે.